

શેઠ ડી. એમ. પોલીટેકનીક ઇન હોર્ટીકલ્ચર, મોડેલ ફાર્મ ખાતે નવા પ્રવેશ પામેલ
વિદ્યાર્થીઓ માટે ઓરીઅન્ટેશન કાર્યક્રમ યોજાયો.

શેઠ ડી. એમ. પોલીટેકનીક ઇન હોર્ટીકલ્ચર ખાતે તારીખ ૨૬.૧૧.૨૦૨૧ ના રોજ પ્રથમ વર્ષમાં પ્રથમ સેમેસ્ટરમાં નવા પ્રવેશ પામેલ ૪૨ વિદ્યાર્થીઓ (૨૨ છોકરા અને ૨૦ છોકરીઓ) માટે ઓરીઅન્ટેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન માટે ડો.એન. આઈ. શાહ, આચાર્ય અને ડીનશ્રી, બાગાયત મહાવિદ્યાલય, આકૃત્યુ, આણંદ ની ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં એકેડેમિક ઇન્ચાર્જ, ડો. વિ.કે.પટેલે વિદ્યાર્થીઓનું, મહેમાન અને સ્ટાફનું શાબ્દિક તથા ફૂલોથી સ્વાગત કરી નવીન વિદ્યાર્થીઓ તથા મહેમાનશ્રી અને સ્ટાફ નો પરિચય કરાવવામાં આવ્યો ત્યાર બાદ નવી નિમાયેલ એસ.આર.સી બોડીએ પોતાનો પરિચય આપ્યો. એકેડેમિક ઇન્ચાર્જશ્રી ડો. વિ.કે.પટેલે કોલેજ ના નિયમો, લેકચરનાં ટાઈમ, હાજરી અને પરીક્ષાના નિયમો ની છણાવટ પૂર્વક જાણકારી આપેલ. હોસ્ટેલ રેક્ટરશ્રી ડો. આઈ. એન ભાભોરે હોસ્ટેલના નિયમો, સ્કોલરશીપ, જમવાની સેલ્ફ મેસ તથા આરોગ્ય સેવા માટે હોસ્પિટલ અને ડોક્ટર ની જાણકારી આપેલ. એસ.આર.સી ચેરમેન ડો. આર. જે. મકવાણાએ કોલેજની રમત ગમત, ખેલકુદ, જુદા જુદા દિવસની ઉજવણી, મહેમાનોના પ્રેરણા પ્રવચન, એન.એસ.એસ ની પ્રવૃત્તિ વગેરેની ઉંડાણ પૂર્વક જાણકારી આપેલ. ફાર્મ મેનેજર ડો. એસ. વિ. મહેડાએ વિદ્યાર્થીઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ માટે ફાર્મના ઉપયોગ અંગેની જાણકારી આપેલ. અત્રેની કોલેજમાં ઉપલબ્ધ લાઇબ્રેરી, ઇન્ટરનેટ કનેક્ટેડ કોમ્પ્યુટર લેબ, રીડિંગ રૂમ, ટેબલ ટેનિસ કોર્ટ, વોલીબોલ મેદાન તેમજ નાનું રમત ગમત મેદાનની સુવિધાઓની વિદ્યાર્થીઓને જાણકારી આપેલ. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ પંચાલે કોલેજ અને હોસ્ટેલ લાઈફ સાથે અનુકૂળ કઈ રીતે થવું તથા બાગાયત ક્ષેત્રમા કારકિર્દી કઈ રીતે બનાવી તેની રસપ્રદ સમજ આપેલ. વિશેષ ઉપસ્થિતિમાં અત્રે પધારેલ આચાર્ય અને ડીનશ્રી, બાગાયત મહાવિદ્યાલય . ડો.એન. આઈ. શાહ સાહેબે સ્નાતક અને ડિપ્લોમા કોલેજ ના અભ્યાસની બાગાયત ક્ષેત્રે રોજગારી તેમજ સ્વરોજગારીની તકો, વધુ અભ્યાસની તકો સાથે બાગાયત ક્ષેત્રમાં નવા વિકસિત થતા ક્ષેત્રની ખૂબજ છણાવટ પૂર્વક વાર્તાલાપ આપેલ. અંતમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને મુંઝવતા પ્રશ્નોને પણ ચર્ચા કરવામાં આવી.



नवा प्रवेश पाभेल विद्यार्थीओ माटे ओरीअन्टेशन कार्यक्रम